

K.Z. LEASING & FINANCE LTD.

REGD. OFFICE : DESHNA CHAMBERS, H/H. KADVA PATIDAR VADI, USMANPURA,
ASHRAM ROAD, AHMEDABAD-380014.(GUJARAT) PHONE : 079-27543200
CIN L 65910 GJ 1986 PLC 008864

31th may, 2023.

To,
The Deputy Manager,
Department of Corporate Services,
Bombay Stock Exchange Limited
Dalal Street, Fort
Mumbai - 400 001.

BSE Company Code: **511728**

Dear Sir,

Sub.: Compliance under Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015.

As per the reference above, we hereby submit you the Newspaper copy of the Notice of Audited Financial results for the quarter and yearended on 31.03.2023, as published in the Newspaper in English as well as Gujarati.

Kindly take note of the same.

Thanking you,

Yours Faithfully,

For, K Z LEASING AND FINANCE LIMITED

Ankit P. Patel

ANKIT P.PATEL
Director & CFO
(DIN: 02901371)



**ANKIT
PRAVINKU
MAR
PATEL**

Digitally signed by ANKIT PRAVINKU PATEL
DN: cn=ANKIT PRAVINKU PATEL, o=K.Z. LEASING & FINANCE LIMITED, ou=K.Z. LEASING & FINANCE LIMITED, email=ANKIT.PRAVINKU@KZLEASING.COM, c=IN
Date: 2023.05.31 14:43:45 +05'30'

SHARDUL SECURITIES LIMITED						
CIN : L50100MH1985PLC036937						
G-12, Tulsiani Chambers, 212 Nariman Point, Mumbai - 400 021. Tel No. : 91 22 46032806/07						
Website : www.shardulsecurities.com e-mail id : investors@shriyam.com						
Extract of Standalone & Consolidated Financial Results for the Quarter and Year ended 31st March, 2023						
Sr. No.	Particulars	Standalone		Consolidated		Year Ended
		Quarter Ended	Year Ended	Quarter Ended	Year Ended	
		31-Mar-23 Audited	31-Mar-22 Audited	31-Mar-23 Audited	31-Mar-22 Audited	
1	Total Income From Operations (Net)	(445.51)	120.27	349.09	(446.15)	207.09
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	(496.22)	81.17	179.57	(566.57)	122.09
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(496.22)	81.17	179.57	(566.57)	122.09
4	Net Profit / (Loss) for the period after tax	(419.80)	65.25	120.16	(468.80)	96.31
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) after tax and Other Comprehensive Income after tax)	(2,152.84)	2,629.92	(2,696.95)	(3,024.92)	3,147.14
6	Paid-up Equity Share Capital (face value Rs 10 each)	1,749.84	1,749.84	1,749.84	1,749.84	1,749.84
7	Reserves (excluding revaluation reserve as shown in the Balance Sheet)	-	-	-	-	-
8	Earnings per equity share of face value of Rs. 10/- each (not annualised)	(2.40)	0.37	0.69	(2.68)	0.55
	a) Basic (In Rs.)	(2.40)	0.37	0.69	(2.68)	0.55
	b) Diluted (In Rs.)	(2.40)	0.37	0.69	(2.68)	0.55

Note :-

- The above is an extract of the detailed Quarterly Financial Results filed with the Stock Exchange under regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Quarterly Financial Results are available on the Company website i.e. www.shardulsecurities.com and the Stock Exchange website i.e. www.bseindia.com.
- The audit committee reviewed the above results and subsequently approved by the Board of Directors at their meeting held on 29th May, 2023. The Statutory Auditors of the Company have carried out audit of the above financial results of the company.

For Shardul Securities Limited
Yogendra Chaturvedi
Executive Director & CEO
DIN : 00013613

Place:- Mumbai
Date :- 29.05.2023

DEEP ENERGY RESOURCES LIMITED (FORMERLY KNOWN AS DEEP INDUSTRIES LIMITED)												
CIN:L63090G11991PLC014833 REGI. OFFICE : 12A & 14, ABHISHREE CORPORATE PARK, AMBULI BOPAL ROAD, AMBULI, AHMEDABAD - 380058												
Ph.: 02717-298510 Fax: 02717-298520 E-mail : info@deepenergy.org website: www.deepenergy.org												
STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31 st MARCH, 2023 (₹ In Lakhs except per share data)												
Sr No.	Particulars	Standalone				Consolidated						
		Quarter ended		Year ended		Quarter ended		Year ended				
		31.03.2023 Audited	31.12.2022 Unaudited	31.03.2022 Audited	31.03.2023 Audited	31.03.2023 Audited	31.12.2022 Unaudited	31.03.2023 Audited	31.03.2022 Audited			
1	Total Income from Operations (net)	473.96	744.30	12.88	1,665.50	43.72	2,045.09	811.58	86.67	3,375.74	287.34	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	15.47	117.10	0.13	370.56	3.59	79.84	45.22	8.68	311.33	53.89	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	15.47	117.10	0.13	370.56	3.59	79.84	45.22	8.68	311.33	53.89	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	11.14	89.39	0.21	279.47	3.19	76.25	14.35	15.71	216.21	46.13	
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	11.14	89.39	0.21	279.47	3.19	76.25	14.35	15.71	216.21	46.13	
6	Equity Share Capital (Face Value of ₹ 10/- Per Share)	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	
7	Earning per share of ₹ 10/- each (from Continuing and Discontinuing Operations)	0.03	0.28	0.00	0.87	0.01	0.24	0.04	0.03	0.65	0.10	
	Basic (In ₹.)	0.03	0.28	0.00	0.87	0.01	0.24	0.04	0.03	0.65	0.10	
	Diluted (In ₹.)	0.03	0.28	0.00	0.87	0.01	0.24	0.04	0.03	0.65	0.10	

Notes: (1) The above is an extract of the detailed format of quarter and annual financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the financial results for the quarter and year ended 31st March, 2023 are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (www.deepenergy.org).

(2) The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held on 29th May, 2023.

(3) Figures of quarter ended March 31, 2023 and March 31, 2022 are the balancing figures between audited figures in respect of the full financial year and the year to date figures upto the third quarter of the relevant financial year which were subjected to limited review by Auditors.

(4) Figures of previous reporting periods have been regrouped/reclassified wherever necessary to correspond with the figures of the current reporting period.

For, DEEP ENERGY RESOURCES LIMITED
Sd/-
Shail Savla
Managing Director
(DIN: 08763064)

Place : Ahmedabad
Date : 29.05.2023

K.Z. LEASING AND FINANCE LTD.						
CIN: L65910GJ1986PLC00864						
Regd. Office : Deshna Chambers, B/h. Kadwa Patidar Wadi, Usmanpura, Ashram Road, Ahmedabad - 380014. Phone: 079-27543200.						
EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31/03/2023 (Rs. In Lakhs)						
Sr No	Particulars	Quarter ended on 31/03/2023 Audited	Quarter ended on 31/12/2022 Unaudited	Quarter ended on 31/03/2022 Audited	Year ended on 31/03/2023 Audited	Year ended on 31/03/2022 Audited
1	Total Income from Operations (net)	40.73	61.55	(0.53)	195.42	224.20
2	Net Profit / (Loss) from ordinary activities before tax	(31.45)	32.45	(34.85)	39.18	22.45
3	Net Profit / (Loss) for the period after tax	(41.97)	32.45	(34.85)	28.66	22.45
4	Paid-up Equity Share Capital (Share of Rs.10/- each)	304.12	304.12	304.12	304.12	304.12
5	Reserves (excluding Revaluation reserve as shown in the Balance Sheet of Previous year)	-	-	-	-	-
6	Earnings per share (EPS)	(1.38)	1.07	(1.15)	0.94	0.74
	a. Basic	(1.38)	1.07	(1.15)	0.94	0.74
	b. Diluted	(1.38)	1.07	(1.15)	0.94	0.74

Notes: (1) The above results were Reviewed by the Audit committee and taken on record by Board of Directors of the Company at its meeting on 30/05/2023. The above results have been reviewed by the Statutory Auditors of the Company.

(2) The above is an extract of the detailed format of Quarterly financial results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure requirements) Regulation 2015. The full format of financial results is available on the Company's website : www.kzgroup.in and Stock Exchange website : www.bseindia.com

Place : Ahmedabad For, K. Z. Leasing & Finance Ltd.
Sd/- Pravin Kumar K. Patel, Managing Director - DIN : 00841628
Date : 30-05-2023

DYNAMIC MICROSTEPPERS LIMITED						
CIN: L45206MH1985PLC036261						
Reg Office: 506, Maruthi Arcade, Above Axis Bank, Near Garware Subhash Road, Vile Parle (East) Mumbai - 400 057, Maharashtra, India. Tel No.: 022-26842631						
Fax No.: 022-26842631 Email id: dynamicmicrostepperslimited@gmail.com						
Website: www.dynamicmicrosteppers.com						
EXTRACT OF THE STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED ON MARCH 31, 2023 Amount in INR						
Sr. No.	Particulars	Standalone				
		Quarter ended 31.03.2023	Year ended 31.03.2023	Quarter ended 31.03.2022		
1	Total Income from operations	-	-	-		
2	Net Profit (+)/Loss for the period (before tax, Exceptional and/or Extraordinary items)	(302,354)	(995,052)	(214,423)		
3	Net Profit (+)/Loss for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(302,354)	(995,052)	(214,423)		
4	Net Profit (+)/Loss for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(302,354)	(995,052)	(214,423)		
5	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(302,354)	(995,052)	(214,423)		
6	Equity share capital	34,488,000	34,488,000	34,488,000		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	(45,062,673)	(45,062,673)	(44,067,621)		
8	Earning per share (of Rs. 10/- each) for continuing and discontinued operations-					
	a. Basic:	(0.09)	(0.29)	(0.06)		
	b. Diluted:	(0.09)	(0.29)	(0.06)		

Notes:

- The above is an extract of the detailed format of quarterly Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly/ Annual audited Financial Results are available on the websites of the Stock Exchange (www.bseindia.com) and the website of the Company (www.dynamicmicrosteppers.com)
- Previous years figures have been regrouped/rearranged wherever necessary to make them comparable.
- The above results, has been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on May 29th, 2023 as per Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

For Dynamic Microsteppers Limited
Sd/- CHETAS ASHWIN SHAH
Director - DIN: 06783061

Place : Mumbai
Date : 29/05/2023

EQUITAS SMALL FINANCE BANK LTD.	
(FORMERLY KNOWN AS EQUITAS FINANCE LTD)	
Registered Office: No.769, Spencer Plaza, 4th Floor, Phase-II, Anna Salai, Chennai TN - 600 002. # 044-42995000, 044-42995050	
Branch : 305-306, 3rd Floor, Abhishree Adroit, Near Sunrise Mall, Mansi Circle, Judges Bunglow Road, Bodakdev, Ahmedabad, Gujarat. 380015	

DEMAND NOTICE

NOTICE UNDER SECTION 13 (2) OF THE SARFAESI ACT, 2002

NOTICE is hereby given that the following borrower/s have availed loan from Equitas Small Finance Bank Ltd (ESFB). The said borrower/s had/have failed to pay Installments and their loan account has been classified as Non-Performing Asset as per the guidelines issued by RBI. The details of the secured immovable property/ies, loan and the amounts outstanding as on date payable by the borrower/s are mentioned below. The borrower(s) and the public in general are informed that the undersigned being the Authorized Officer, the secured creditor has initiated action against the following borrower(s) under the provisions of the SARFAESI Act, 2002 and not to deal with the said property, on failure to repay the outstanding dues indicated against their names within **60 (Sixty) days of this notice**, the undersigned will exercise any one or more of the powers under sub-section (4) of Section 13 of the SARFAESI Act, including power to take possession of the property/ies and sell the same.

Name of the Borrower(s) / Guarantor(s) (Name of The Branch)	Demand Notice Date and Amount	Description of Secured Asset (Immovable Property)
Loan No. : 700000829947/ EMFSURTA0027461 & 700000537153 / ELPURTA0027462.		Schedule Of The Security (s) Residential Property Owned By Mr. Some Nath S/o Mr. Shiv Prasad & Mr. Shailesh Devi W/o Mr. Shiv Prasad
1. Mr. Some Nath S/o Mr. Shiv Prasad (Applicant/Borrower & Mortgagor)	20/05/2023 & Rs. 4,26,447/- as on 18.05.2023.	All that right and interest of property bearing flat no. 201 on 2nd floor admeasuring super built up area 584.70 sq. fts i.e. 54.34 sq. mtrs and built up area 315.91 sq. fts i.e. 29.36 sq. mtrs with undivided share in land underneath said building known and named as "SARGAM RESIDENCY" on sub plot no. 27, plot no.198, 199,200 total admeasuring area 609.66 sq. yards i.e. 509.75 sq. mtrs in society known as "LABDHI BUNGLOWS" admeasuring area 3-16-94 sq. mtrs, non agriculture land situated land bearing revenue survey no. 34, 35, block no. 97/pakce 2 (as per KJP block no. 97A/198, 97A/199 and 97A/200)of village Sanar, sub district-palsana, District-Surat. Four corners of said property:- North : Adj. plot no. 197, South : Adj. plot no. 201, East : Adj. road, West : Adj. road
2. Mr. Shailesh Devi W/o Mr. Shiv Prasad (Co-Aplicant/ Co-Borrower & Mortgagor)		
3. Mr. Suraj S/o Mr. Shiv Prasad (Co-Aplicant/ Co-Borrower & Mortgagor)		
Also at : Goredih Post-Mahaita, Sahjanwa, Gorakhpur, Uttar Pradesh- 273209.		
Loan No. : 700000813493/ EMFSURTA0025861 & 700000517982 / ELPURTA0025862		Schedule Of The Security (s) Residential Property Owned By Mr. Gautam Rajeshkumar Ramnath S/o Mr. Ramnath & Mr. Gautam Ramnath S/o Mr. Ramfear & Mrs. Gautam Dhanpattidevi W/o Mr. Ramnath
1. Mr. Gautam Rajeshkumar Ramnath S/o Mr. Ramnath (Applicant/Borrower & Mortgagor)	20/05/2023 & Rs. 11,41,313/- as on 18.05.2023.	All that pieces and parcel of property bearing plot no. 35 (after KJP plot no. 111/35), admeasuring area as per booking plan 88.01 sq. mtrs (as per passing plan admeasuring 159.79 sq. mtrs) (as per construction admeasuring 55.29 sq. mtrs) along with undivided share in society road and COP admeasuring area 81.93 sq. mtrs total admeasuring area 169.94 sq. mtrs in residential society known and named as "SHREE RAJ MANDIR RESIDENCY" non agriculture land situated bearing R.S. No. 221/222/2 its block no. 111 admeasuring hec 1-88-18 aare sq. mtrs of village syadala, talka-opad, district-surat. Four corners of said property:- North : Adj. Road, South: Adj. Plotno. 36, East: Adj. Road, West: Adj. Plotno. 34
2. Mr. Gautam Ramnath S/o Mr. Ramfear (Co-Aplicant/ Co-Borrower & Mortgagor)		
3. Mr. Gautam Dhanpattidevi W/o Mr. Ramnath (Co-Aplicant/ Co-Borrower & Mortgagor)		
Also at : 144/B/10, H-2, EWS Awas, Kasod Surat- 394107.		

Loan No. : 700005384629/ EMFSURTA0037140 & 7000005388470 / ELPURTA0037141		Schedule Of The Security (s) Residential Property Owned By Mrs. Rita Harkesh Nishad W/o Harkesh
1. Mr. Harkesh S/o Mr. Baldeva (Applicant/Borrower)	19/05/2023 & Rs. 5,93,443/- as on 18.05.2023.	All that piece and parcel of land and building bearing flat no. 103 on the 1st floor admeasuring 24.44 sq. mtrs built up area, along with 2.53 sq. mtrs undivided share in the land of road in Shree Ram Residency along with 6.44 sq. mtrs undivided share in the land underneath the said building constructed on plot no. 29 admeasuring 396.78 sq. mtrs along with 155.99 sq. mtrs undivided share in the land of road & COP totally admeasuring 552.77 sq. mtrs in Shree Residency situated at old block no. 434,435, 437 after re survey new block no. 484, 486, 488, 489 (after block consolidation new block no. 484) of moje village halidhar, sub district kamrej, District-Surat. Four corners of said property:- North : Adj. Flat no. 102, South : Open Space, East : Open Space, West : Adj. Passage & Flat No. 104
2. Mrs. Reeta Harkesh Nishad W/o Mr. Harkesh (Co-Aplicant/ Co-Borrower & Mortgagor)		
3. Mr. Ram Bachan W/o Mr. Budari Nishad (Guarantor)		
Also at : Hinduabad, Sultanpur, Uttar Pradesh- 228161.		
Loan No. : 700005238103/ EMFSURTA0035947 & 700005238799 / ELPURTA0035948		Schedule Of The Security (s) Residential Property Owned By Mrs. Sunitidevi Vinod Shah W/o Vinod Shah & Mr. Raja Kumar Sah S/o Vinod Shah
1. Mr. Raja Kumar Sah S/o Mr. Vinod (Applicant/Borrower & Mortgagor)	20/05/2023 & Rs. 9,34,992/- as on 18.05.2023.	All that pieces and parcels of land building bearing plot no. 94 admeasuring 44.27 sq. mtrs, together with undivided proportionate share in road and COP admeasuring 31.84 sq. mtrs, total admeasuring 76.11 sq. mtrs at "VRAJ RESIDENCY" situated on the land bearing block no. 150 (Rev.S.No. 306) admeasuring hecior are 1-26-47 sq. mtrs of village svadale, sub district: Taluka opad, district, surat.
2. Mrs. Sunita Devi W/o Mr. Vinod (Co-Aplicant/ Co-Borrower & Mortgagor)		
3. Mr. Vinodprasad Chhatrprasad kansara W/o Mr. Chhatrprasad (Co-Aplicant/ Co-Borrower)		
Also at : Main Road, Sahajpura, Post- Gandali, Shahar, Sawai Madhopur, Rajasthan- 322204.		
Loan No. : 700004570940/ EMFSURTA0032590 & 700004570953 / ELPURTA0032591		Schedule Of The Security (s) Residential Property Owned By Mrs. Karan Bai W/o Ramhans Gurjar & Mr. Ramhans Gurjar S/o Shri Narayan
1. Mr. Ramhans Gurjar S/o Mr. Shri Narayan (Applicant/Borrower & Mortgagor)	20/05/2023 & Rs. 4,41,604/- as on 18.05.2023.	All that right and interest in property bearing flat no. A-102, admeasuring super built up area 474.14 sq. feet i.e. 44.06 sq. mtrs and built up area 300.60 sq. feet i.e. 27.94 sq. mtrs and carpet area 275.00 sq. feet i.e. 25.56 sq. mtrs, on 1st floor together with undivided proportionate land underneath said building known as building no. A and project known as "SHIVSHAKTI RESIDENCY" on plot no. 252 and 276 in society known as "SHREE VINAYAK VILLA" non agriculture land situated land bearing revenue survey no. 57/1, 57/2 and 58 block no. 63 (as per KJP block no. 63/252, 63/276) total block admeasuring area 40975.00 sq. mtrs of village dasan, sub dist: Palsana, Dist- Surat.
2. Mrs. Karan Bai W/o Mr. Ramhans Gurjar (Co-Aplicant/ Co-Borrower & Mortgagor)		
Also at : Main Road, Sahajpura, Post- Gandali, Shahar, Sawai Madhopur, Rajasthan- 322204.		
Loan No. : 7000084855/ EMFSURTA0031709 & 700000594299 / ELPURTA0031710		Schedule Of The Security (s) Residential Property Owned By Mr. Anand Tiwari S/o Bal Govind & Mrs. Mina Devi W/o Bal Govind
1. Mr. Anand Tiwari S/o Mr. Bal Govind (Applicant/Borrower & Mortgagor)	19/05/2023 & Rs. 4,43,929/- as on 18.05.2023.	All right title and interest in property bearing flat no. 103 super built up area admeasuring 588.00 sq. mtrs and built up area admeasuring 294.00 sq. fts equivalent to 27.32 sq. mtrs on 1st floor together with undivided proportionate share in underneath land and common road and COP of "AVIRA RESIDENCY" constructed on land bearing plot no. 103 and 104 admeasuring 155.54 sq. yard equivalent to 130.06 sq. mtrs at "LAXMI NARAYAN SOCIETY", situated on the land bearing vlock no. 116 of village kadodara, taluka palsana, district surat.
2. Mrs. Mina Devi W/o Mr. Bal Govind (Co-Aplicant/ Co-Borrower & Mortgagor)		
Also at : 37, PO Nauradesh, Naudera, Pratappgarh, Uttar Pradesh- 230306. And Flat No. 103, Avira Residency, Palsana, Kadodara, Surat- 394327.		

Loan No. : 700004570940/ EMFSURTA0032590 & 700004570953 / ELPURTA0032591		Schedule Of The Security (s) Residential Property Owned By Mrs. Karan Bai W/o Ramhans Gurjar & Mr. Ramhans Gurjar S/o Shri Narayan
1. Mr. Ramhans Gurjar S/o Mr. Shri Narayan (Applicant/Borrower & Mortgagor)	20/05/2023 & Rs. 4,41,604/- as on 18.05.2023.	All that right and interest in property bearing flat no. A-102, admeasuring super built up area 474.14 sq. feet i.e. 44.06 sq. mtrs and built up area 300.60 sq. feet i.e. 27.94 sq. mtrs and carpet area 275.00 sq. feet i.e. 25.56 sq. mtrs, on 1st floor together with undivided proportionate land underneath said building known as building no. A and project known as "SHIVSHAKTI RESIDENCY" on plot no. 252 and 276 in society known as "SHREE VINAYAK VILLA" non agriculture land situated land bearing revenue survey no. 57/1, 57/2 and 58 block no. 63 (as per KJP block no. 63/252, 63/276) total block admeasuring area 40975.00 sq. mtrs of village dasan, sub dist: Palsana, Dist- Surat.
2. Mrs. Karan Bai W/o Mr. Ramhans Gurjar (Co-Aplicant/ Co-Borrower & Mortgagor)		
Also at : Main Road, Sahajpura, Post- Gandali, Shahar, Sawai Madhopur, Rajasthan- 322204.		
Loan No. : 7000084855/ EMFSURTA0031709 & 700000594299 / ELPURTA0031710		Schedule Of The Security (s) Residential Property Owned By Mr. Anand Tiwari S/o Bal Govind & Mrs. Mina Devi W/o Bal Govind
1. Mr. Anand Tiwari S/o Mr. Bal Govind (Applicant/Borrower & Mortgagor)	19/05/2023 & Rs. 4,43,929/- as on 18.05.2023.	All right title and interest in property bearing flat no. 103 super built up area admeasuring 588.00 sq. mtrs and built up area admeasuring 294.00 sq. fts equivalent to 27.32 sq. mtrs on 1st floor together with undivided proportionate share in underneath land and common road and COP of "AVIRA RESIDENCY" constructed on land bearing plot no. 103 and 104 admeasuring 155.54 sq. yard equivalent to 130.06 sq. mtrs at "LAXMI NARAYAN SOCIETY", situated on the land bearing vlock no. 116 of village kadodara, taluka palsana, district surat.
2. Mrs. Mina Devi W/o Mr. Bal Govind (Co-Aplicant/ Co-Borrower & Mortgagor)		
Also at : 37, PO Nauradesh, Naudera, Pratappgarh, Uttar Pradesh- 230306. And Flat No. 103, Avira Residency, Palsana, Kadodara, Surat- 394327.		

Loan No. : 7000084855/ EMFSURTA0031709 & 700000594299 / ELPURTA0031710		Schedule Of The Security (s) Residential Property Owned By Mr. Anand Tiwari S/o Bal Govind & Mrs. Mina Devi W/o Bal Govind
1. Mr. Anand Tiwari S/o Mr. Bal Govind (Applicant/Borrower & Mortgagor)	19/05/2023 & Rs. 4,43,929/- as on 18.05.2023.	All right title and interest in property bearing flat no. 103 super built up area admeasuring 588.00 sq. mtrs and built up area admeasuring 294.00 sq. fts equivalent to 27.32 sq. mtrs on 1st floor together with undivided proportionate share in underneath land and common road and COP of "AVIRA RESIDENCY" constructed on land bearing plot no. 103 and 104 admeasuring 155.54 sq. yard equivalent to 130.06 sq. mtrs at "LAXMI NARAYAN SOCI

સીમા પર ચીનનું સૈન્ય ૧ ઈંચ પણ આગળ વધ્યું નથી: સીડીએસ

પુના તા.૩૦ કદમથી કદમ મિલાવતા જોઈને હું આનંદ અનુભવું છું. આજે દેશની મહિલાઓ રાષ્ટ્રીય ક્ષત્રીઓ જોઈઈ છે તે પણ ગૌરવની વાત છે અને

જો કે દેગસાંગ અને દેમચોક સિવાયના ક્ષેત્રમાં સ્થિતિ ભારતના નિયંત્રણમાં: પુનામાં નેશનલ ડિફેન્સ એકેડેમીની પાર્સીંગ આઉટ પરેડને સંબોધન

પુરુષો સમકક્ષ જવાબદારી મહિલાઓને મળવા લાગી છે તે એક સૌથી મહત્વનું કદમ છે. પુનામાં નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પાર્સીંગ આઉટ પરેડ સમયે સંબોધન કરતા સીડીએસ જનરલ ચૌહાણે ૧૪૪મી કોર્પસની પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં સંબોધનમાં જણાવ્યું કે પુરુષો સાથે મહિલા કેડેટને પણ

એર ઈન્ડિયાની ફલાઈટમાં પેસેન્જરે કૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો

નવીદિલ્હી, તા. ૩૦ એર ઈન્ડિયાની ફલાઈટમાં ફરી એકવાર કૂ મેમ્બર સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ૨૯ મેના રોજ અમારી ફલાઈટ એઆઈટી૨૨માં એક મુસાફરે ગેરવર્તન કર્યું હતું. આરોપી પેસેન્જરે કૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી તેમાંથી એક પર હુમલો પણ કર્યો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ પેસેન્જરે આક્રમક વર્તન કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો.

K.Z. LEASING AND FINANCE LTD. Q1 2023 Financial Results

Table with 7 columns: Sr No, Particulars, Quarter ended on 31/03/2023 Audited, Quarter ended on 31/12/2022 Unaudited, Quarter ended on 31/03/2022 Audited, Year ended on 31/03/2023 Audited, Year ended on 31/03/2022 Audited. Rows include Total Income from Operations, Net Profit, etc.

VIVID MERCANTILE LIMITED Q1 2023 Financial Results

Table with 7 columns: Sr No, Particulars, Quarter ended on 31-03-2023 Audited, Quarter ended on 31-12-2022 Unaudited, Quarter ended on 31-03-2022 Audited, Year ended on 31-03-2023 Audited, Year ended on 31-03-2022 Audited. Rows include Total Income, Net Profit, etc.

ધી કોસમોસ કો-ઓપ.લેંક લિ. (પ્રાઇવેટ લિમિટેડ)

આથી, આમો નીચે સહી કરનાર ધી કોસમોસ કો.ઓ.લેંક લી. ના ધી સીક્યુરીટી ઇન્વેસ્ટમેન્ટ ડેપોઝિટીવ ઓફ ફાઇનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યુરીટી ઇન્વેસ્ટમેન્ટ ઓફ ૨૦૦૨ (એક્ટ ૫૪ ઓફ ૨૦૦૨) અન્વયે ના આધિકૃત અધિકારી છીએ. આમો ઉપરોક્ત કાર્યાલની કલમ ૧૩(૧૨) અને ધી સીક્યુરીટી ઇન્વેસ્ટમેન્ટ (એનફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ ના નિયમ ૩ અન્વયે તા. ૨૨/૦૬/૨૦૨૨ ના રોજ પ્રાઇવેટ મેસર્સ પહેલાવા કોર્પોરેશન કે જેના પ્રોપાઇટર શ્રીમતી.સંજના સંયુક્ત કાર્ય, રહે. ફલેટ નં. એસ-૬, સુવર્ણ એપાર્ટમેન્ટ, અર્બુન આશ્રમ રોડ, રાણીપ, અમદાવાદ-૩૮૨૪૮૦ અને કે જે તેમના લેણાં બાકી રકમ રૂ.૭૨,૫૨,૨૪૨.૮૩ (અંકે રૂ.સેત્તે વાણ બાવળ હજાર બસો સુમ્મણીસ રૂપિયા ત્યાંથી પૈસા પૂરા.) + વ્યાજ, નોટીસ મળેલી દીન દુઃમાં ભરપાઈ કરવા બાબત ની માંગણા નોટીસ આપેલ હતી.

આપણે શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છીએ કે સીમા વિવાદ વધે નહીં અને આપણા પ્રદેશ પરનો જે દાવો છે તેની કાયદેસરતા પણ બનાવી રાખી છે. સીમા વિવાદ ઉકેલવો તે અત્યંત મહત્વની બાબત છે અને તેમાંજ ઉમેર્યું કે દેપસાંગ તથા દેમચોક ક્ષેત્રને છોડીને તમામ સરહદ પર યોગ્ય સ્થિતિ છે.

જાહેર નોટીસ નગર રચના યોજના નંબર ૪૧૮ (ગામડી-રોપડા) આથી જાહેર જનતાને જણાવવાનું કે મુસદ્દારૂપ નગર રચના યોજનાની હદમાં સમાવિષ્ટ કરવામાં આવેલ જમીનોના જમીન માલીકો/હિત ધરાવતી વ્યક્તિઓને મંજૂર થયેલ મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૪૧૮ (ગામડી-રોપડા)ની કામચલાઉ પુનઃરચના દરખાસ્તોની વિગતોની જાણ ઉપલબ્ધ કરનારા પ્રમાણે વ્યક્તિગત નોટીસ દ્વારા કરવામાં આવેલ છે તેમ છતાં કોઈને સરનામાં અભાવે કે બીજા કારણોસર મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૪૧૮ (ગામડી-રોપડા)ની કામચલાઉ પુનઃરચના દરખાસ્તોની વિગતોની જાણ કરતી નોટીસ મળેલ ન હોય તેવી વ્યક્તિઓ/ઈસમોને આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે મુસદ્દારૂપ નગર રચના યોજનાની કામચલાઉ પુનઃરચના દરખાસ્તો અન્વયે જે કોઈ વ્યક્તિઓ/હિત ધરાવતી વ્યક્તિઓને મોબીલ/બેબીટ રજુખાત કરવાની હોય તેવી વ્યક્તિએ આ નોટીસ પ્રસિધ્ધ થયા તારીખથી દિન ૧૦(દસ)માં નીચે જણાવેલ સરનામે જરૂરી આધાર પુરાવા સાથે રજુખાત કરવા વિનંતી છે.

ઉક્ત મુસદ્દારૂપ નગર રચના યોજનાઓની કામચલાઉ પુનઃરચના દરખાસ્તોની વિગત સમજાવવાની વ્યવસ્થા અનેની કચેરીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન કરવામાં આવેલ છે.

સ્થળ: અમદાવાદ નગર રચના અધિકારી, તા. ૨૪-૫-૨૦૨૩ (નગર નિયોજક-૩) નગર રચના યોજના એકમ-૩ અમદાવાદ

PUBLIC NOTICE I the undersigned Devender Singh Yadav, under the instruction of my clients Surendra Mohanlal Kapoor and Amrita Kapoor, resident of - D17/347, SECTOR -3, ROHINI, DELHI-85, declare that they are senior citizens and since last 4 years their health is deteriorating, and without the knowledge of my clients, their son LOVELY KAPOOR had started two companies which are SHRI NATH and R.K. INTERNATIONAL, and had fraudulently taken signature of SURENDRA MOHANLAL KAPOOR on the documents pertaining to the above mentioned companies. Due to being illiterate it was impossible for my clients to know the meaning and nature of the document. That now they have come to know that LOVELY KAPOOR has done fraud on the name of SURENDRA MOHANLAL KAPOOR in relation to the said companies and he is untraceable. They did not know about his fraud and his illegal work which he was doing. That on earlier occasion also he had declared my client SURENDRA MOHANLAL KAPOOR dead for his personal benefit. That my clients are not associated with the fraud or illegal work which he has done by taking my client SURENDRA MOHANLAL KAPOOR'S signature fraudulently in the documents of the above mentioned companies. That my clients have already disowned LOVELY KAPOOR and his wife SUPRIYA KAPOOR and waived off their rights of inheritance from their movable & Immovable assets through public notice issued in JAI HIND - AHMEDABAD NEWSPAPER, and now they are disowning their grandson RAYAAN KAPOOR S/o LOVELY KAPOOR and waving off his rights of inheritance from their movable & Immovable assets. That now and in future if LOVELY KAPOOR, SUPRIYA KAPOOR and RAYAAN KAPOOR does any transaction with any person(s) then they will not be held liable and responsible, which please be noted.

પંજાબ નેશનલ બેંક Punjab National Bank

સર્કલ SASTRA, છકા માળે, ગુજરાત ભવન, એમ.જે. લાયબ્રેરી પાસે, એલિસડ્રીવ, અમદાવાદ-૩૮૦૦૦૬. પરિશિષ્ટ-IV, [અંતગત નિયમ ૮(૧)] કબજા નોટીસ (સ્વાચી મિલકત માટે) આથી નિમનલિખિત પંજાબ નેશનલ બેંક, ના અધિકૃત અધિકારીએ સરહદે સી ઓફ ૨૦૦૨ હેઠળ સિક્યુરીટી ઇન્વેસ્ટમેન્ટ (એનફોર્સમેન્ટ) રૂલ્સ-૨૦૦૨ ની સત્તાની રૂએ કલમ ૧૩(૧૨) સાથે વ્યવસ્થા રૂલ ૩, સિક્યુરીટી ઇન્વેસ્ટમેન્ટ (એનફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ હેઠળ તા. ૨૨.૦૬.૨૦૨૩ ના રોજ માંગણા નોટીસ મોકલી કરવાદાર / જામીનદાર / ગોરોદાર શ્રી સુદામણ પટેલ અને શ્રીમતી વીલાસબેન વલાહી નો નોટીસમાં જણાવેલ રૂ. ૧૩,૪૭,૭૨૩.૫૨ (અંકે રૂ. તેર લાખ સુડતાલીસ હજાર સાતસો ત્રેવીસ અને બાવળ પૈસા પુરા), તા. ૨૨.૦૬.૨૦૨૩ સુધી, સાથે સંપૂર્ણ વસૂલાત ન વાય ત્યાં સુધી આગળનું વ્યાજ, મચાઈઓ આ નોટીસની તારીખથી ૬૦ દિવસોમાં ચૂકવવા માટે જણાવેલ હતું.

DEEP ENERGY RESOURCES LIMITED (FORMERLY KNOWN AS DEEP INDUSTRIES LIMITED)

Table with 12 columns: Sr No, Particulars, Standalone (Audited, Unaudited), Year ended (Audited, Unaudited), Consolidated (Audited, Unaudited). Rows include Total Income from Operations, Net Profit, etc.

રૂ.૧૦-૧૦૦ તથા ૨૦૦૦ની બનાવટી ચલાણી નોટો ઓછી ઝડપાઈ છે એક વર્ષમાં રૂ.૫૦૦ની ૯૧૧૧૦ બનાવટી નોટો ઝડપાઈ નવી દિલ્હી: દેશમાં રૂ.૨૦૦૦ની ચલાણી નોટો પરત લેવાની જાહેરાત બાદ રીઝર્વ બેન્ક એક ઈન્ડિયાએ કહ્યું હતું કે હવે પછા રૂ.૫૦૦ની બનાવટી ચલાણી નોટોનો ફેલાવો છે અને ૨૦૨૨-૨૩ના વર્ષમાં દેશભરમાં ૯૧૧૧૦ પીસ રૂ.૫૦૦ની બનાવટી ચલાણી નોટો ઝડપાઈ હતી. રીઝર્વ બેન્કે તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે જે બનાવટી ચલાણી નોટો ઝડપાઈ તેમાં ૪.૬% નોટો રીઝર્વ બેન્કમાં અને ૯૫.૪% નોટો અન્ય બેન્કોમાં બંધા થઈ હતી. જ્યારે રૂ.૧૦૦ની ૭૮૬૬૯ બનાવટી નોટો પણ આજ સમયમાં ઝડપાઈ હતી અને રૂ.૨૦૦ની ૨૭૨૫૮ નોટો ઝડપાઈ હતી. રૂ.૨૦૦૦ની ૯૮૦૬ બનાવટી ચલાણી નોટો ઝડપાઈ હતી.

Table with 5 columns: Particular, Quarter ended on 31.03.2023, Year ended (31.03.2022, 31.03.2021). Rows include Total Income from operation, Net Profit/Loss, etc.

અર્ટ નિર્માણ લિમિટેડ CIN: L45200GJ2011PLC064107 રજિસ્ટર્ડ ઓફિસ: 410, જેબીઆર ઍર્કેડ, સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૬૦. (O): 079 27710511 (E): es@artnirman.com (W): www.artnirman.com

Extract of Audited Standalone Financial Results for the Quarter and year ended 31st March, 2023. (in Lakh)

Table with 5 columns: Particular, 31.03.2023 (Audited), 31.12.2022 (Unaudited), 31.03.2023 (Audited), 31.03.2022 (Audited), 31.03.2021 (Audited). Rows include Total Income from operation, Net Profit/Loss, etc.

Notes: 1. The above Audited financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meeting held on 29.05.2023. 2. The figures of the previous period/year have been regrouped / recast / reclassified wherever considered necessary to conform to the current year's presentation. 3. The above is an extract of the detailed format of Audited Financial Results filed by the Company with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Audited Financial Results are available on the company website www.artnirman.com as well as on the stock exchange website viz. www.nseindia.com.

Date: 30.05.2023 Place: Ahmedabad For ART NIRMAN LTD Sd/- Ashokkumar R. Thakker Chairman & Managing Director